



ચર્યવિલ વિસ્તારની પૂરની સ્થિતિ માટે આપત્તિ રાહત ઉપલબ્ધ છે

બ્રમ્પટન, ઓન્ટારિયો (01 એપ્રિલ 2022) – ફેબ્રુઆરીમાં ચર્યવિલ વિસ્તારમાં આવેલ પૂરની ઘટનાના જવાબમાં ઓન્ટારિયો સરકાર [ડિઝાસ્ટર રિકવરી અસિસ્ટન્સ ફોર ઓન્ટારિયન્સ \(DRAO\) પ્રોગ્રામ સક્રિય કરી રહ્યા છે](#) જેથી બ્રમ્પટનના નિવાસીઓ અને પરિવારો જેઓ આ કુદરતી આફતથી પ્રભાવિત થયા હોય તેમને મદદ મળી શકે.

આ આફત સહાયતા કાર્યક્રમ પ્રાથમિક રહેઠાણ અને તેમાં રહેલ વિષયવસ્તુ, નાના વ્યવસાય, વાડી અથવા બિન નફાકારક સંસ્થા માટે લાગુ છે. આ ભંડોળ કટોકટીના ખર્ચાઓ અને વીમા દ્વારા આવરી નહીં લેવામાં આવી હોય એવી આવશ્યક મિલકતના સમારકામ અથવા બદલવાના ખર્ચ માટે લાગુ પડે છે. રહેવાસીઓને જણાવવામાં આવે છે કે તેઓ તેમની ખાનગી વીમા કંપનીઓ સાથે આરણ અને ખર્ચની સમીક્ષા અંગે વાત કરે.

અરજી રજૂ કરવાની અંતિમ તારીખ શુક્રવાર, 29 જુલાઈ 2022ના રોજ છે.

પાત્રતા અને આવરણ વિશે વધુ માહિતી, વિસ્તારનો નકશો અને માર્ગદર્શિકા ontario.ca/disasterassistance પર મળી શકશે.

પૂર સુરક્ષા

વસંત આગળ વધે તેમ તેમ તાપમાનમાં વધારો થવાની ધારણા સાથે, રહેવાસીઓને બદલાતી જતી હવામાનની પેટર્ન અને તે અનુસાર તેમની મિલકત પર દેખરેખ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

પૂરની સ્થિતિમાં તમારી તૈયારી છે તેની ખાતરી કરવા માટે તમે કેટલાક પગલાં લઈ શકો છો. કેચ બેસિન અને ડાઉનસ્પાઉટ્સમાંથી કોઈપણ વધારાનો કાટમાળ કે કચરો સાફ કરો જેથી વરસાદ, પીગળતો હિમ અને બરફ મુક્તપણે વહી શકે જેને જવા માટે જગ્યા મળી જાય..

જો પૂર આવે તો;

- જો પાવર બંધ કરવા તમારે પાણીમાંથી ચાલીને જવું પડે તેમ હોય તો તેમ ક્યારેય ન કરવું. પાવર બંધ કરવા માટે હાયડ્રો વન બ્રેમ્પટન (Hydro One Brampton)નો સંપર્ક કરવો.
- એવા ઓરડામાં પ્રવેશ કરવો નહીં જ્યાં પાણીનો સંપર્ક જીવંત વિદ્યુત આઉટલેટ, સાધનો અથવા વાયરો સાથે થયો હોય.
- પાણીનો અસાધારણ ભરાવો થયો હોય તેની જાણકારી 3-1-1 પર અથવા 311@brampton.caને ઈમેલ કરીને આપવી (દા ત., રહેવાસી ધરાવતા માર્ગો પર પાણીના ખાબોચિયા ભરાયા હોય).

પૂરના પાણી ઉતરી જાય ત્યાર પછી:

- ડુગ અને પાણીના સ્ત્રાવને લગતા લાંબા ગાળાના જોખમો સામે રક્ષણ આપવા માટે તમારા ઘર/સંપત્તિની યોગ્ય સફાઈ થાય તે સુનિશ્ચિત કરો.
- પાણી ભરેલા રસ્તાઓ પર ચાલશો નહીં અથવા વાહન ચલાવવા નહીં. પાણીના ભરાવાથી માર્ગો અને કૂટપાથની સુરક્ષા પ્રભાવિત થાય તેમ બની શકે.

તૈયાર રહો

- જોખમોની જાણકારી લો અને તમારા ઘરને પ્રભાવિત કરી શકે તેવા કોઈપણ જોખમોથી વાકેફ રહો.
- એવી કટોકટીની યોજના બનાવો જેની જાણ સમસ્ત પરિવારજનને હોય.
- મૂળભૂત પુરવઠા સાથેની ઈમરજન્સી કીટ તૈયાર કરો જે તમને ઓછામાં ઓછા 72 કલાક સુધી ટકાવી શકે.
- તમારી વીમા કંપની સાથે વાત કરી લેશો જેથી ખાતરી રહે કે શું તમારી પાસે ઉચિત આવરણ છે કે કેમ.

બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસ પાસેથી વધુ માહિતી અને પૂર અંગેના સુરક્ષા સૂચનો માટે અહીં મુલાકાત લો Brampton.ca/prepared અને તેમને ટ્વિટર [@BEMOprepared](https://twitter.com/BEMOprepared) પર ફોલો કરો.



Service and Information Update

मिडिया संपर्क (MEDIA CONTACT):

सीटी ओड् ब्रॅम्पटन मल्टिकल्चरल मिडिया

multiculturalmedia@brampton.ca